



ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન

પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન
ફાયર સ્ટેશન પાછળ, સેક્ટર-૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૬
ફોન નંબર-૦૭૯ ૨૩૨ ૨૦૪૪૦, ફેક્સ નંબર-
૦૭૯ ૨૩૨ ૨૧૪૧૯

Email:gmc8gandhinagar@gmail.com



તા.૨૫/૦૫/૨૦૨૩

ક્રમાંક: ગાં.મ.ન.પા./સંકલન/ફ.નં-૧૬/૨૦૧૭/૧૧૦૦૨ /૨૦૨૩

વિષય:- માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ ની કલમ-(૪)(ખ) હેઠળ જાહેર કરવાનું થતું
પ્રોએક્ટીવ ડિસ્ક્લોઝર(PAD) અદ્યતન કરવા બાબત.
સંદર્ભ:- (૧) ગુજરાત સરકાર, સામાન્ય વહીવટ વિભાગ, પરિપત્ર ક્રમાંક: પીએડી-૧૦-૨૦૦૭-
૩૩૫૩૬૪-આરટીઆઇસેલ, સચિવાલય, ગાંધીનગર, તા.૦૧-૦૫-૨૦૦૯.

શ્રીમાન,

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, સંદર્ભદર્શિત પરિપત્ર અનુસાર સચિવાલયના વિભાગો,
તેમના નિયંત્રણો હેઠળના ખાતાના વડા અને બોર્ડ/કોર્પોરેશન તથા સર્વે જાહેર સત્તામંડળોએ પ્રોએક્ટીવ
ડિસ્ક્લોઝર (PAD) તૈયાર કરીને પુસ્તિકા સ્વરૂપે પ્રસિધ્ધ કરીને વિભાગની વેબસાઇટ ઉપર તથા નાગરિકોને
સરળતાથી મળી રહે તે રીતે ઉપલબ્ધ કરાવવાની રહે છે. આથી સંદર્ભદર્શિત પત્ર અન્વયે તૈયાર કરવાના
થતાં પ્રોએક્ટીવ ડિસ્ક્લોઝર(PAD) માટે <https://rti.gov.in/rti-act-2005-gujarati.pdf> લીંક પરના પાના
નં.૩૯ થી ૬૨માં દર્શાવેલા મુદ્દાની માહિતી અત્રેની સંકલન શાખાને તા.૩૦-૦૫-૨૦૨૩ સુધીમાં મોકલી
આપવા જણાવવામાં આવે છે.

બિડાણ:- ઉદાહરણ દર્શાવતું પત્રક.

(કેયુર પી. જેઠવા),
નાયબ મ્યુનિસિપલ કમિશનર,
ગાંધીનગર મહાનગરપાલિકા,

ગાંધીનગર
૦/૮.૬
૨૫/૦૫/૨૩

પ્રતિ,

તમામ શાખાધિકારીશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર તરફે અમલવારી કરવા સાડું.

નકલ સવિનય રવાના:-

માન.કમિશનરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર તરફે જાણ સાડું.



गांधीनगर म्युनिसिपल कोर्पोरेशन

पंडित दिनदयाल त्रिपाठ्याय भवन

क्षेत्र स्टेशन पाछा, सेक्टर-१७, गांधीनगर-382016

फोन नंबर-०७९९ २३२ २०४४०, फेक्स नंबर-०७९९ २३२ २१४१९

Email:gmc8gandhinagar@gmail.com



भारत 2023

यशुषि कृत्यम्

ONE EARTH • ONE FAMILY • ONE FUTURE

क्रमांक गां.म.न.पा/ईजनेरी शाखा/ सिविल-१/ ११८२३ /२०२३,

ता.०९/०९ /२०२३

प्रति,

फडीवटी अधिकारीश्री (संकलन),

गांधीनगर मखानगरपालिका,

गांधीनगर

विषय : माहिती अधिकार अधिनियम, २००५ची कलम (४) (अ) खेळण खेळेर करवानुं थतुं प्रो अेकटीव डिस्कोअर (PAD) अघतन करवा बाबत.

संदर्भ: १) गुजरात सरकार सामान्य वडिवट विभाग, परिपत्र क्रमांक: पीअेडी-१०-२००७-३३५३६४-

आरटीआईसेल, सचिवालय, गांधीनगर ता.०१/०५/२००९

२) क्रमांक/गां.म.न.पा./संकलन/इ.न.१६/२०१७/११००२ /२०२३, ता. २५/०५/२०२३

श्रीमान,

उपर्युक्त विषय अन्वये संदर्भ दर्शित पत्र२)थी आपनी शाखा द्वारा संदर्भ दर्शित पत्र १) अन्वये माहिती अधिकार अधिनियम, २००५ची कलम (४) (अ) खेळण खेळेर करवानुं थतुं प्रो अेकटीव डिस्कोअर (PAD) अघतन करवा माहिती मंगायवामां आवेल इती ते बाबते सिविल ईजनेरी-०१ शाखाने <https://rti.gov.in/rti-act-2005-gujarat.pdf> लींक परना पाना नं.३९ थी दर परनी मांगेल माहिती मुजबनुं पत्रक तैयार करी आ साथे सादर करवामां आवे छे, ते आपनी आजु साइ.

अधी
नं.५६५
०६/०६/२३
०६/०८/२३

बिदाय: मांग्या मुजबनी माहितीनुं पत्रक

नायब कार्यपालक ईजनेर (ई.या.)

सिविल ईजनेरी शाखा-०१

गांधीनगर मखानगरपालिका

नक्ष सादर खाना:

सीडी ईजनेरीश्री, गांधीनगर मखानगरपालिका तरफुं आजु साइ.

રાઇટ ટુ ઇન્ફરમેશન એક્ટ ૨૦૦૫ સંદર્ભે તથા હુકમ ૧૦૦૮/૦૫-૦૬ સંદર્ભે કલમ
૪-૧(ખ) અન્વયે ખાતાની હાલ સુધીની માહિતી બાબત.
સિવિલ ઇજનેરી-૧, ગાંધીનગર મહાનગરપાલિકા

(૧) સંસ્થા, કામગીરીઓ અને ફરજોની વિગતો:
વિભાગ: સિવિલ-૧, ગાંધીનગર મહાનગરપાલિકા
કામગીરીઓ/ફરજો :

- ગાંધીનગર મહાનગરપાલિકાના સિવિલ ઇજનેરી શાખા-૧ માં સેક્ટર-૧ થી ૩૦ અને ઈન્સોડા, ફતેહપુરા, બોરીજ, બાસણ, ગોકુલપુરા, પાલજ, ધોળાકુવા ગામોમાં બગીચા, પી.એચ.સી., પેવર બ્લોક તથા અન્ય બાંધકામને લગતી તમામ કામગીરી.
- ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બગીચાઓના કામ માટે અરજી આવ્યા પછી મદદનીશ ઇજનેર દ્વારા સર્વે કરી ડીટેઇલ એસ્ટીમેટ, ડ્રોઇંગ, ડી.ટી.પી.ની કામગીરી
- ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જનભાગીદારી ૮૦:૨૦ દ્વારા પેવરબ્લોકની કામગીરી
- ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાર્ષિક ભાવોથી મંજુર યુનિટ રેટની કામગીરી
- ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેક્ટર-૧ થી ૩૦ અને પેરીફેરી ૭ ગામની સ્કુલ મરામત તેમજ નવી બનાવવાની કામગીરી
- ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેક્ટર-૧ થી ૩૦ કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી
- ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગામોમાં આર.સી.સી.રોડ બનાવવાની કામગીરી
- ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેક્ટર ૧ થી ૩૦ માં સ્ટ્રોમ વોટર નાખવાની કામગીરી.

(ર) પોતાના અધિકારી અને કર્મચારીઓની સત્તાઓ તથા ફરજો:

ગાંધીનગર મહાનગરપાલિકાના સિવિલ-૧ શાખાના અધિકારી/કર્મચારીઓના નામ, હોદ્દો, પગાર તથા કામગીરીની વિગત.

અ.નં	નામ	હોદ્દો તથા પગારની વિગત	કામની વિગત
૧	મનહરભાઈ કે પટેલ(આ.સો.) E-mail: Gmc.civil1@gmail.com	નાયબ કાર્યપાલક ઇજનેર(આઉટ સોર્સિંગ) ૪૦,૦૦૦/-	• મુદા ન.૧ મુજબના સિવિલ કામો અંતર્ગત નાયબ કાર્યપાલક ઇજનેર તરીકેની તમામ વહિવટી તથા ટેકનીકલ કામગીરી
૨	નિખિલભાઈ ડી .પરમાર E-mail: nikhilparmar101@gmail.com	મદદનીશ ઇજનેર બેઝિક પગાર- ૪૪,૯૦૦/-	• મુદા ન.૧ મુજબના મદદનીશ સિવિલ ઇજનેર તરીકેની શાખા અધીકારીશ્રી દ્વારા સોંપવામાં આવેલ કામગીરી
૩	હર્ષભાઈ ઠક્કર(આ.સો.) E-mail: harshthakkar.gam@gmail.com	મદદનીશ ઇજનેર (આઉટ સોર્સિંગ) બેઝિક પગાર- ૩૨,૯૦૭/-	• મુદા ન.૧ મુજબના મદદનીશ સિવિલ ઇજનેર તરીકેની શાખા અધીકારીશ્રી દ્વારા સોંપવામાં આવેલ કામગીરી
૪	માલવ ઠક્કર E-mail: thakkarmalav26@gmail.com	અધિક મદદનીશ ઇજનેર બેઝિક પગાર- ૩૯,૯૦૦/-	• મુદા ન.૧ મુજબના અધિક મદદનીશ સિવિલ ઇજનેર તરીકેની શાખા અધીકારીશ્રી દ્વારા સોંપવામાં આવેલ કામગીરી
૫	ધવલગીરી ગોસ્વામી E-mail: dhavalgoswami16@gmail.com	અધિક મદદનીશ ઇજનેર બેઝિક પગાર- ૩૯,૯૦૦/-	• મુદા ન.૧ મુજબના અધિક મદદનીશ સિવિલ ઇજનેર તરીકેની શાખા અધીકારીશ્રી દ્વારા સોંપવામાં આવેલ કામગીરી
૬	અવેશ ખેડુવોરા E-mail: aveshkheduvora.civilengg@gmail.com	અધિક મદદનીશ ઇજનેર બેઝિક પગાર- ૩૯,૯૦૦/-	• મુદા ન.૧ મુજબના અધિક મદદનીશ સિવિલ ઇજનેર તરીકેની શાખા અધીકારીશ્રી દ્વારા સોંપવામાં આવેલ કામગીરી
૭	વિનોદ રબારી E-mail: vinodrabari4@gmail.com	અધિક મદદનીશ ઇજનેર (આઉટ સોર્સિંગ) બેઝિક પગાર- ૩૧,૩૪૦/-	• મુદા ન.૧ મુજબના અધિક મદદનીશ સિવિલ ઇજનેર તરીકેની શાખા અધીકારીશ્રી દ્વારા સોંપવામાં આવેલ કામગીરી
૮	વિવેક પંડ્યા E-mail: pandyavivek83@yahoo.com	અધિક મદદનીશ ઇજનેર (આઉટ સોર્સિંગ) બેઝિક પગાર- ૩૧,૩૪૦/-	• મુદા ન.૧ મુજબના અધિક મદદનીશ સિવિલ ઇજનેર તરીકેની શાખા અધીકારીશ્રી દ્વારા સોંપવામાં આવેલ કામગીરી
૯	રોનક પટેલ E-mail: ronak6105@gmail.com	અધિક મદદનીશ ઇજનેર (આઉટ સોર્સિંગ) બેઝિક પગાર- ૩૧,૩૪૦/-	• મુદા ન.૧ મુજબના અધિક મદદનીશ સિવિલ ઇજનેર તરીકેની શાખા અધીકારીશ્રી દ્વારા સોંપવામાં આવેલ કામગીરી
૧૦	મયંક ગોહિલ E-mail: mayankgohil299@gamail.com	અધિક મદદનીશ ઇજનેર (આઉટ સોર્સિંગ) બેઝિક પગાર- ૩૧,૩૪૦/-	• મુદા ન.૧ મુજબના અધિક મદદનીશ સિવિલ ઇજનેર તરીકેની શાખા અધીકારીશ્રી દ્વારા સોંપવામાં આવેલ કામગીરી
૧૧	મયુરસિંહ રાજપુત E-mail: mayursinhrajaput44@gmail.com	અધિક મદદનીશ ઇજનેર (આઉટ સોર્સિંગ) બેઝિક પગાર- ૩૧,૩૪૦/-	• મુદા ન.૧ મુજબના અધિક મદદનીશ સિવિલ ઇજનેર તરીકેની શાખા અધીકારીશ્રી દ્વારા સોંપવામાં આવેલ કામગીરી

૩) નિરીક્ષણ અને જવાબદારીના સાધનો સહિત નિર્ણય લેવાની પ્રક્રિયા :

સમક્ષ મંજૂરી મેળવતી વખતે મુખ્યત્વે નીચે પ્રમાણે કાર્યકર્યનિ ક્ષણ કરવામાં આવે છે.

મદદનીશ ઇજનેર દ્વારા સાઇટ ઉપર માપ લઈ એસીમેટ, ડ્રોઇંગ, ડી.ટી.પી. રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ, એસીમેટ, ડ્રોઇંગ, ડી.ટી.પી. નાવલ કાર્યવાહક ઇજનેરશ્રી દ્વારા નિરીક્ષણ કરી સિદ્ધી ઇજનેરશ્રી દ્વારા નિરીક્ષણ કરી નિર્ણય અર્થેની કાર્ય જરૂરી કલેક્ટલ સહ કેન્ડુનિસિપલ કમિશનરશ્રી સમક્ષ રજૂ કરવામાં આવે છે, જે કિસ્સામાં અંતિમ સલાહિકારી એન્ડુનિસિપલ કમિશનરશ્રી હોય છે તે કિસ્સામાં એન્ડુનિસિપલ કમિશનરશ્રી સમક્ષ રજૂ કરવામાં આવે છે. તેમજ જે કિસ્સામાં સ્થાયી સમિતિ કે સામાન્ય સભા દ્વારા નિર્ણય કરવાર હોય તો સ્થાયી સમિતિ/સામાન્ય સભામાં દરખાસ્ત મોકલવામાં આવે છે.

૪) પોતાના કાર્યો બજાવવા માટે નકકી કરાયેલા ધોરણો :

વિભાગમાં રોજ બરોજના કાર્યો પાર પાડવા કરવા માટે જી.પી.એમ.સી. એક્ટની જોગવાઈઓ, નિયમો તથા અત્રેની જારી કરેલ સમયે પરીપત્રો અનુસાર કાર્યો કરવાના રહે છે. આ ઉપરાંત, સરકારશ્રી દ્વારા સમયે સમયે બહાર પાડવામાં આવતી મૌખિક/લેખિત સૂચનાઓ આદેશોનું અમલીકરણ રોજીંદી કરજો બજાવવા અર્થે કરવાનું રહે છે.

૫) પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો સૂચનાઓ નિયમ સંગ્રહો અને રેકોર્ડ :

વિભાગની મુખ્યત્વે કામગીરીમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સક્ષમ અધિકારી તથા પદાધિકારી દ્વારા કરવામાં આવેલ પરીપત્રો, દરવો વિગેરે ધ્યાને લેવાના રહે છે.

૬) પોતાના દ્વારા અથવા અંકુશ હેઠળ રમાયેલ વિવિધ કેટેગરીના દસ્તાવેજોનું નિવેદન :

કચેરીઓના કાર્યપધ્યતિમાં જરૂરી એવા મુજબત રજીસ્ટરોની નિભાવણી કરવામાં આવે છે. જેવા કે,

સિવિલ-૧ શાખાનું વર્કશીટ રજીસ્ટર, ફાઇલ મુવમેન્ટ રજીસ્ટર અને સિવિલ બાંધકામની સાઈટ પર નિભાવવાના થતા અન્ય રજીસ્ટર

૭) તેની નીતિ ઘડવાના અથવા તેના અમલીકરણ સંબંધિત જાહેર જનતાના સભ્યો દ્વારા રજુઆત કરાયેલી અથવા તેની ચર્ચા માટે રહેલી કોઈપણ પ્રકારની વ્યવસ્થાની વિગતો :

નીતિ ઘડવાના અથવા તેના અમલીકરણ સંબંધિત જાહેર જનતાના સભ્યો દ્વારા રજુઆત કરાયેલી અથવા તેની ચર્ચા માટે રહેલી કોઈપણ પ્રકારની વ્યવસ્થાની વિગતો લોકો સાથે સંકળાયેલી સંસ્થા હોય લોકોના ચુંટાયેલા પ્રતિનિધિઓની બનેલી સ્થાયી સમિતિ, સામાન્ય સભા અથવા સંબંધિત વિભાગને સ્પર્શતી સમિતિ દ્વારા અધિકાર પરત્વે નિર્ણય લેવામાં આવે છે.

૯) પોતાના ચલણના હેતુ માટે અથવા તેના ભાગ તરીકે રચાયેલી બે કે તેથી વધુ વ્યક્તિઓ ધરાવતાં બોર્ડ્સ, કાઉન્સિલ કમિટીઓ અને અન્ય મંડળોનું નિવેદન અને બોર્ડ્સ કાઉન્સિલ કમિટીઓ અને અન્ય મંડળોની બેઠકો જાહેર પ્રજા માટે ખુલ્લી છે કે કેમ ? અથવા આવી બેઠકની વિગતો જાહેર પ્રજા મેળવી શકે કે કેમ ?

અત્રેની કચેરીને લાગુ પડતું નથી.

૯) પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની ડીરેક્ટરી :

મુદ્દા નં.૨ માં સમાયેલ યાદી મુજબ

૧૦) તેના નિયમમાં પુરી પડાયેલ પડતરની પધ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રાપ્ત કરાયેલ માસિક પગાર

માસિક પગાર અંગેની વિગત મુદ્દા નં.૨ ના લીસ્ટમાં આવરી લેવામાં આવેલ છે.

૧૧) તમામ યોજનાઓની વિગતો, સુચિત ખર્ચાઓ અને કરાયેલ યુક્વણીના અહેવાલો દર્શાવતા તેની તમામ એજન્સીને ફાળવેલ બજેટ :

અનુ. નં.	યોજનાનું નામ /સંદર્	પ્રવૃત્તિ	પ્રવૃત્તિ શરૂ કર્યાની તારીખ	પ્રવૃત્તિના અંતની અંદાજેલ તારીખ	સૂચિત રકમ (કરોડમાં)	મંજૂર થયેલ રકમ (કરોડમાં)	છૂટી કરેલ/ચૂકવેલ રકમ કરોડમાં (હપતાની રાંખ્યા)	છેલ્લા વર્ષનું અંતિમ ખર્ચ (કરોડમાં)	કાર્યાની યુગ્મવના માટે સંપૂર્ણપણે કામગીરી માટે જવાબદાર અધિકારી
૧	૧૫ નાણા પંચ	સ્ટ્રોમ લોટર પાઇપલાઇન નાંખવાની કામગીરી સે-૧ થી ૩૦	૧૯/૧૦/૨૦૨૨	૧૮/૦૯/૨૦૨૩	૧૧.૩૪	૧૨.૦૭	૨.૯૨ (૩ હપતા)	૦.૮૮	સિવિલ એજનેર, કાર્યપાલક એજનેર, સિટી એજનેર
૨	ગ્રામ્ય પેરી ફેરી	બોરીજ ગામે સી.સી. રોડ બનાવવાની કામગીરી	૦૪/૧૦/૨૦૨૨	૦૩/૦૭/૨૦૨૩	૩.૭૩	૨.૯૫	૦.૯૨ (૨ હપતા)	૦.૯૨	સિવિલ એજનેર, કાર્યપાલક એજનેર, સિટી એજનેર
૩	ગાર્ડન મેન્ટેનન્સ બજેટ કોડ-૧૧૨, એકાઉન્ટ કોડ- ૪૦૧૫૬	ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમા સેક્ટર ૨૫ તથા ૨૮ ખાતે ગાર્ડન રિનોવશન ની કામગીરી	૨૯/૦૩/૨૦૨૩	૨૮/૧૨/૨૦૨૩	૩.૮૫	૩.૩૬	૦	૦	સિવિલ એજનેર, કાર્યપાલક એજનેર, સિટી એજનેર
૪	ગાર્ડન મેન્ટેનન્સ બજેટ કોડ-૧૧૨, એકાઉન્ટ કોડ- ૪૦૧૫૬	ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમા સેક્ટર ૩૦ અને બોરીજ ખાતે ગાર્ડન રિનોવશન ની કામગીરી	૩૦/૦૪/૨૦૨૩	૦૨/૦૧/૨૦૨૪	૪.૬૫	૩.૮૮	૦	૦	સિવિલ એજનેર, કાર્યપાલક એજનેર, સિટી એજનેર
૫	ગાર્ડન મેન્ટેનન્સ બજેટ કોડ-૧૧૨, એકાઉન્ટ કોડ- ૪૦૧૫૬	ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમા સેક્ટર ૨૬ ગ્રીન સિટી ગાર્ડન રિનોવશન ની કામગીરી	૨૯/૦૩/૨૦૨૩	૨૮/૧૨/૨૦૨૩	૧.૪૦	૧.૩૭	૦	૦	સિવિલ એજનેર, કાર્યપાલક એજનેર, સિટી એજનેર
૬	ગાર્ડન મેન્ટેનન્સ બજેટ કોડ-૧૧૨, એકાઉન્ટ કોડ- ૪૦૧૫૬	ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમા સેક્ટર- ૧,૨૩,૨૧(૧),૨૧(૨),૩ ગાર્ડન રિનોવશન ની કામગીરી	૩૦/૦૪/૨૦૨૩	૦૨/૦૧/૨૦૨૪	૬.૪૬	૫.૭૪	૦	૦	સિવિલ એજનેર, કાર્યપાલક એજનેર, સિટી એજનેર
૭	બજેટ કોડ-૧૧૨, એકાઉન્ટ કોડ- ૪૦૧૭૮	ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેક્ટર-૨,૨૪ અને ૨૯ પી.એચ.સી. ખાતે ફર્નીચરની કામગીરી	૨૪/૦૩/૨૦૨૩	૨૩/૦૭/૨૦૨૩	૧.૫૪	૧.૦૯	૦	૦	સિવિલ એજનેર, કાર્યપાલક એજનેર, સિટી એજનેર

૧૨) ફાળવાયેલી રકમ અને આ કાર્યક્રમોથી ફાયદો મેળવનારની વિગતો સહિત સબસીડી સહિત કાર્યક્રમોનો અમલનો પ્રકાર

લાભાર્થીઓને લગતી માહિતી હોઈ, અત્રેની કચેરીને લાગુ પડતું નથી.

૧૩) તેના દ્વારા અપાયેલી છૂટછાટો, પરવાનગીઓ અને સત્તા સોંપણી મેળવનારની વિગતો :

અત્રેની કચેરી કોઈ છૂટછાટો, પરવાનગીઓ કે અધિકૃતકરણ કરવામાં આવતું નથી.

૧૪) ઇલેક્ટ્રોનિક્સ ફોર્મ્સમાં ઘડાયેલી તેના દ્વારા રાખયેલી અથવા તેને ઉપલબ્ધ માહિતીના સંદર્ભની વિગતો :

અત્રેની કચેરીની લાગુ પડતું નથી.

૧૫) પુસ્તકાલય અથવા વાંચનખંડના કામના ક્લાકો સહિત માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો, જો જાહેર ઉપયોગ માટે તેની જાળવણી કરાઈ હોય તો :

અત્રેની શાખામાં પુસ્તકાલય કે વાંચનખંડ ઉપલબ્ધ નથી.


૧૬) જાહેર માહિતી/અપીલ અધિકારીના હોદ્દો અને અન્ય વિગતો

અપીલ અધિકારી	જાહેર માહિતી અધિકારી
નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા	મદદનીશ ઇજનેર

૧૭) સિવિલ-૦૧ શાખાનું સને ૨૦૨૩-૨૪નું અંદાજપત્ર

- આ સાથે પત્રકમાં સામેલ છે.

સિવિલ-૧ શાખાનું વહીવટી માળખું



ગાંધીનગર મહાનગરપાલિકા
રવન્યુ ખર્ચ અંદાજ પત્ર વર્ષ ૨૦૨૩-૨૦૨૪

બજેટ કોડ	સહર	૦૧/૦૪/૨૦૧૯ થી ૩૧/૦૩/૨૦૨૦ ની ખર્ચાત રકમ	૦૧/૦૪/૨૦૨૦ થી ૩૧/૦૩/૨૦૨૧ ની ખર્ચાત રકમ	૦૧/૦૪/૨૦૨૧ થી ૩૧/૦૩/૨૦૨૨ ની ખર્ચાત રકમ	૦૧/૦૪/૨૦૨૨ થી ૩૧/૦૩/૨૦૨૩ ની ખર્ચાત રકમ	૦૧/૦૪/૨૦૨૩ થી ૩૧/૦૩/૨૦૨૪ ની ખર્ચાત રકમ	૦૧/૦૪/૨૦૨૩ થી ૩૧/૦૩/૨૦૨૪ ની ખર્ચાત રકમ	૦૧/૦૪/૨૦૨૩ થી ૩૧/૦૩/૨૦૨૪ ની ખર્ચાત રકમ	૦૧/૦૪/૨૦૨૩ થી ૩૧/૦૩/૨૦૨૪ ની ખર્ચાત રકમ	
૧	૩	૫	૬	૭	૮	૯	૧૦	૧૧	૧૨	
૨૦૧૮	૦.૦૦	૦.૦૦	૧૨૫.૦૦	૩૦૦.૦૦	૨૦૦.૦૦	૨૦૦.૦૦	૦.૦૦	૨૫૦.૦૦	૭૫૦.૦૦	૨૫૦.૦૦
૨૦૧૯	૦.૦૦	૦.૦૦	૫.૦૦	૨.૦૦	૨.૨૮	૧.૦૦	૧.૦૦	૩.૨૮	૩.૦૦	૩.૦૦
૨૦૨૦	૦.૦૦	૦.૦૦	૫.૦૦	૧૫.૦૦	૪.૦૦	૨.૦૦	૨.૦૦	૬.૦૦	૧૦.૦૦	૧૦.૦૦
૨૦૨૧	૦.૦૦	૦.૦૦	૩૭૫.૦૦	૬૦૦.૦૦	૪૨૦.૦૦	૨૫૦.૦૦	૨૫૦.૦૦	૬૭૦.૦૦	૬૬૭.૦૦	૬૬૭.૦૦
૨૦૨૨	૦.૦૦	૦.૦૦	૫૧૦.૦૦	૯૧૭.૦૦	૬૨૬.૨૮	૨૫૩.૦૦	૨૫૩.૦૦	૮૭૯.૨૮	૯૩૦.૦૦	૯૩૦.૦૦
૨૦૨૩	૩.૩૯	૦.૪૭	૮.૮૨	૫૦.૦૦	૧.૯૩	૧૫.૦૦	૧૫.૦૦	૧૬.૯૩	૪૦.૦૦	૪૦.૦૦
૨૦૨૪	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૧૦૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૪૦.૦૦	૪૦.૦૦
૨૦૨૫	૭.૭૩	૧૭.૯૫	૧૬૨.૭૯	૪૦.૦૦	૧૮.૦૦	૨૨.૦૦	૨૨.૦૦	૨૯૨.૪૮	૨૦૦.૦૦	૨૦૦.૦૦
૨૦૨૬	૭૨.૨૯	૨૮.૩૦	૧૫૦.૯૩	૧૫૦.૦૦	૧૪૨.૪૮	૧૫૦.૦૦	૧૫૦.૦૦	૨૯૨.૪૮	૧૦૦.૦૦	૧૦૦.૦૦
૨૦૨૭	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૧૦૦.૦૦	૧૦૦.૦૦
૨૦૨૮	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૧૫૦.૦૦	૧૫૦.૦૦	૧૫૦.૦૦	૧૦૦૦.૦૦	૧૦૦૦.૦૦
૨૦૨૯	૦.૦૦	૨૦.૩૮	૧૩૪.૦૪	૫૦૦.૦૦	૪૭૦.૬૨	૨૫૦.૦૦	૨૫૦.૦૦	૯૭૦.૬૨	૪૦૦.૦૦	૪૦૦.૦૦
૨૦૩૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૧૦૦.૦૦	૧૦૦.૦૦	૧૦૦.૦૦	૮૦૦.૦૦	૮૦૦.૦૦

गौधीगिर मंडल गौधीगिर परिषद

रिपोर्ट भरत खडकवाड के नाम पर २०२३-२०२४

क्र.सं.	विवरण	वर्ष	१	२	३	४	५	६	७	८	९	१०	११	१२	१३	१४
501	गौधीगिर मंडल विकास समिति का संचालन के लिए खर्च	20226														
501	गौधीगिर मंडल विकास समिति का संचालन के लिए खर्च	(5)														
501	गौधीगिर मंडल विकास समिति का संचालन के लिए खर्च	20227	0.00	3.38	32.32	200.00	114.11		219.06	333.17	800.00	100.00	800.00	800.00	800.00	800.00
501	गौधीगिर मंडल विकास समिति का संचालन के लिए खर्च	(4)														
501	गौधीगिर मंडल विकास समिति का संचालन के लिए खर्च	20227														
501	गौधीगिर मंडल विकास समिति का संचालन के लिए खर्च	(4)														
601	गौधीगिर मंडल विकास समिति का संचालन के लिए खर्च	20953	3.84	4.07	6.91	150.00	4.29	100.00	104.29	200.00	200.00	200.00	200.00	200.00	200.00	200.00
601	गौधीगिर मंडल विकास समिति का संचालन के लिए खर्च	20972	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	400.00	400.00	400.00	400.00	400.00	400.00
601	गौधीगिर मंडल विकास समिति का संचालन के लिए खर्च		87.25	74.56	349.31	1190.00	751.43	1113.19	1864.62	4280.00	4280.00	4280.00	4280.00	4280.00	4280.00	4280.00
601	गौधीगिर मंडल विकास समिति का संचालन के लिए खर्च															
501	गौधीगिर मंडल विकास समिति का संचालन के लिए खर्च	20209	34.46	46.47	70.40	80.00	38.08	41.92	80.00	150.00	150.00	150.00	150.00	150.00	150.00	150.00
501	गौधीगिर मंडल विकास समिति का संचालन के लिए खर्च	20210	251.09	287.82	354.66	500.00	140.81	259.19	400.00	1000.00	1000.00	1000.00	1000.00	1000.00	1000.00	1000.00
501	गौधीगिर मंडल विकास समिति का संचालन के लिए खर्च	20211	0.00	6.74	6.79	10.00	2.06	6.94	9.00	12.00	12.00	12.00	12.00	12.00	12.00	12.00
501	गौधीगिर मंडल विकास समिति का संचालन के लिए खर्च	20212	16.93	8.07	14.72	20.00	5.33	12.00	17.33	25.00	25.00	25.00	25.00	25.00	25.00	25.00
501	गौधीगिर मंडल विकास समिति का संचालन के लिए खर्च	20214	53.55	71.73	125.41	150.00	66.00	120.00	186.00	250.00	250.00	250.00	250.00	250.00	250.00	250.00
501	गौधीगिर मंडल विकास समिति का संचालन के लिए खर्च	20215	9.08	13.36	14.64	17.00	13.11	13.00	26.11	35.00	35.00	35.00	35.00	35.00	35.00	35.00
501	गौधीगिर मंडल विकास समिति का संचालन के लिए खर्च	20216	0.00	0.85	26.43	150.00	111.37	42.63	161.00	150.00	150.00	150.00	150.00	150.00	150.00	150.00

गांधीनगर महानगरपालिका

क्र. ११११११

डेप्युटी आवड अंदाजपत्र वर्ष २०२३ - २०२४

क्र.सं.	विवरण	०१/०४/२०२३ ३१/०३/२०२३ नी अर्बुत रकम	०१/०४/२०२३ ३१/०३/२०२३ नी अर्बुत रकम	०१/०४/२०२३ ३१/०३/२०२३ नी अर्बुत रकम	०१/०४/२०२३ ३१/०३/२०२३ नी अर्बुत रकम	०१/०४/२०२३ ३१/०३/२०२३ नी अर्बुत रकम	०१/०४/२०२३ ३१/०३/२०२३ नी अर्बुत रकम	०१/०४/२०२३ ३१/०३/२०२३ नी अर्बुत रकम	०१/०४/२०२३ ३१/०३/२०२३ नी अर्बुत रकम	०१/०४/२०२३ ३१/०३/२०२३ नी अर्बुत रकम
१	१. किसानी शाखा									
	रेवन्स अफेयर्स शाखा तलहाल									
१००	३०९०१	०.००	०.००	०.००	०.००	०.००	०.००	०.००	०.००	६०००.००
	३०९०२	०.००	०.००	३००.००	०.००	०.००	०.००	०.००	०.००	०.००
१००	३०९०९	०.००	१२९९.०६	०.००	३३०५.००	०.००	३३०५.००	३६७९.००	३६७९.००	३६७९.००
१११	३०९०९	०.००	१२९९.०६	०.००	१५३०५.००	०.००	१५३०५.००	१६७९.००	१६७९.००	१६७९.००
	३०८०३	३४२२.३८	३२७५.२२	०.००	३२०३.००	१६७२०.००	१९९२३.००	५०२५.००	५०२५.००	५०२५.००
१११	३०८०५	३१५.१६	०.००	२००.००	०.००	११०००.००	११०००.००	३५०००.००	३५०००.००	३५०००.००
१११	३०८१०	०.००	०.००	०.००	५००.००	५००.००	५००.००	३०००.००	३०००.००	३०००.००
१११	३०८०८	३३३.१६	३६८.७०	०.००	१७३६.००	०.००	१७३६.००	९५०.००	९५०.००	९५०.००
	३०८०८	४०७०.७०	३६४३.९२	०.००	५४३९.००	२८२२०.००	३३६५९.००	४३९७५.००	४३९७५.००	४३९७५.००
१११	३०८०६	१६६.४४	०.००	०.००	३०.००	३०.००	३०.००	१३०.००	१३०.००	१३०.००
	३०८०६	१६६.४४	०.००	०.००	३०.००	३०.००	३०.००	१३०.००	१३०.००	१३०.००
१११	३०८११	०.००	०.००	०.००	०.००	०.००	०.००	०.००	०.००	४२.०६
	३०८११	०.००	०.००	०.००	०.००	०.००	०.००	०.००	०.००	४२.०६
१११	३०८०७	०.००	०.००	०.००	११९.७६	३०.२४	१५०.००	३०८.६७	३०८.६७	३०८.६७
	३०८०७	०.००	०.००	०.००	११९.७६	३०.२४	१५०.००	३०८.६७	३०८.६७	३०८.६७
१११	३०८०७	०.००	०.००	०.००	२०८९३.७६	२८२५०.२४	४९१४४.००	५४०९२.६७	५४०९२.६७	५४१३४.७३
	३०८०७	०.००	०.००	०.००	२०८९३.७६	२८२५०.२४	४९१४४.००	५४०९२.६७	५४०९२.६७	५४१३४.७३
१११	३०८०८	५६५१.९०	४९४२.९८	०.००	१५३५७.००	२८२५०.२४	४९१४४.००	५४०९२.६७	५४०९२.६७	५४१३४.७३
	३०८०८	५६५१.९०	४९४२.९८	०.००	१५३५७.००	२८२५०.२४	४९१४४.००	५४०९२.६७	५४०९२.६७	५४१३४.७३

ଅର୍ଥନୀତିର ମହାନିରୂପାନ୍ତି
ଉପକ୍ରମ ମଧ୍ୟ ଭାଗ ୨୦୧୨-୧୩

ଉପକ୍ରମ ମଧ୍ୟ ଭାଗ ୨୦୧୨-୧୩
ଉପକ୍ରମ ମଧ୍ୟ ଭାଗ ୨୦୧୨-୧୩
ଉପକ୍ରମ ମଧ୍ୟ ଭାଗ ୨୦୧୨-୧୩
ଉପକ୍ରମ ମଧ୍ୟ ଭାଗ ୨୦୧୨-୧୩
ଉପକ୍ରମ ମଧ୍ୟ ଭାଗ ୨୦୧୨-୧୩
ଉପକ୍ରମ ମଧ୍ୟ ଭାଗ ୨୦୧୨-୧୩
ଉପକ୍ରମ ମଧ୍ୟ ଭାଗ ୨୦୧୨-୧୩
ଉପକ୍ରମ ମଧ୍ୟ ଭାଗ ୨୦୧୨-୧୩

କ୍ର. ସଂ.	ବିବରଣୀ	୧	୨	୩	୪	୫	୬	୭	୮	୯	୧୦	୧୧	୧୨	୧୩	୧୪	୧୫	୧୬
୩୬୬	୪୦୭୩	୩୫.୫୦	୨୫.୪୦	୫୯.୯୦	୬୦.୯୦	୧୧୬.୩୦	୩୫୦.୦୦	୧୫୦.୦୦	୧୫୦.୦୦	୧୫୦.୦୦	୧୫୦.୦୦	୧୫୦.୦୦	୧୫୦.୦୦	୧୫୦.୦୦	୧୫୦.୦୦	୧୫୦.୦୦	୧୫୦.୦୦
୩୬୭	୪୦୭୪	୫୫.୫୦	୫୫.୫୦	୧୧୧.୦୦	୧୧୧.୦୦	୨୨୨.୦୦	୫୫୫.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦
୩୬୮	୪୦୭୫	୨୫.୫୦	୨୫.୫୦	୫୧.୦୦	୫୧.୦୦	୧୦୨.୦୦	୨୫୫.୦୦	୧୦୨.୦୦	୧୦୨.୦୦	୧୦୨.୦୦	୧୦୨.୦୦	୧୦୨.୦୦	୧୦୨.୦୦	୧୦୨.୦୦	୧୦୨.୦୦	୧୦୨.୦୦	୧୦୨.୦୦
୩୬୯	୪୦୭୬	୫୫.୫୦	୫୫.୫୦	୧୧୧.୦୦	୧୧୧.୦୦	୨୨୨.୦୦	୫୫୫.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦
୩୭୦	୪୦୭୭	୫୫.୫୦	୫୫.୫୦	୧୧୧.୦୦	୧୧୧.୦୦	୨୨୨.୦୦	୫୫୫.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦	୨୨୨.୦୦

ગાંધીનગર મહાનગરપાલિકા
કેપીટલ ખર્ચ અકાઉન્ટ વર્ષ ૨૦૨૩-૨૦૨૪

	3	4	5	6	7	8	9	10	11	12	13	14	15	16
482 415	સેક્ટર કોડ	01/08/2019 39/03/2020 ની ખર્ચે રકમ	05/08/2020 39/03/2020 ની ખર્ચે રકમ	09/08/2021 39/03/2022 ની ખર્ચે રકમ	09/08/2022 39/03/2023 ની ખર્ચે રકમ	01/08/2022 39/03/2023 ની ખર્ચે રકમ	01/08/2023 39/03/2024 ની ખર્ચે રકમ	01/08/2024 39/03/2025 ની ખર્ચે રકમ	01/08/2025 39/03/2026 ની ખર્ચે રકમ	01/08/2026 39/03/2027 ની ખર્ચે રકમ	01/08/2027 39/03/2028 ની ખર્ચે રકમ	01/08/2028 39/03/2029 ની ખર્ચે રકમ	01/08/2029 39/03/2030 ની ખર્ચે રકમ	01/08/2030 39/03/2031 ની ખર્ચે રકમ
1	2													
112	સાબરમતી નદી ઉપર બાસલો ગામને "જ" રોડ સાથે જોડવા કામ પૂર્ણ બાંધકામનો ખર્ચ	0.00	0.00	17.03	10.00	0.00	0.00	0.00	0.00	0.00	50.00	50.00	50.00	50.00
112	ગાં.મ.ન.પા. ની સમગ્ર વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પોર્ટ્સ ક્લબ જીમખાનું તથા સ્નાનગૃહ માટેનો ખર્ચ	0.00	0.00	0.00	10.00	0.00	0.00	0.00	0.00	0.00	10.00	10.00	10.00	10.00
112	ગાં.મ.ન.પા. માં વિવિધ જગ્યાઓએ ઇલેક્ટ્રીક હાઈ માસ લગાવવા માટે નો ખર્ચ	0.00	0.00	0.00	4.65	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
113	કડાસણ વિસ્તારમાં ટાઉનહોલ બાંધકામ માટેનો ખર્ચ	0.00	0.00	0.00	0.00	0.00	4.42	6.00	10.48	400.00	400.00	400.00	400.00	400.00
113	કડાસણમાં સિનિયર સિટીજન પાર્ક અને વાઈબ્રોરીડીંગરૂમ સાથે ના બાંધકામ માટેનો ખર્ચ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	5.00	5.00	50.00	50.00	50.00	50.00	50.00
113	નવા વિસ્તારો વિવિધ સ્વણ જાહેર શૌચાલય બાંધવાનો ખર્ચ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	100.00	100.00	100.00	100.00	100.00
113	કોલવડા અને વાવોલ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ / વાઈબ્રોરી (રીડીંગરૂમ સાથે) તથા અદ્યતન સુવિધાવાળું સ્મશાનગૃહ ના બાંધકામ માટેનો ખર્ચ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	1.00	1.00	50.00	50.00	50.00	50.00	50.00
112	નવા વિસ્તારોમાં ફાયર ચોકી બનાવવાનો ખર્ચ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	100.00	100.00	1500.00	1500.00	1500.00	1500.00	1500.00
113	ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારો માં આસફ્ટ અને સી સી રોડ ના કામ માટેનો ખર્ચ	0.00	0.00	0.00	103.45	2000.00	342.54	307.27	649.81	300.00	300.00	300.00	300.00	300.00
112	ગાં.મ.ન.પા. ના અલગ અલગ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ ના બાંધકામ માટેનો ખર્ચ	0.00	0.00	0.00	0.00	150.00	0.00	10.00	10.00	10.00	10.00	10.00	10.00	10.00
113	ગાં.મ.ન.પા. વિસ્તારમાં નવી ફેનેજ લાઈન સુએઝ પંખોંગ સ્થાન એસટીપી વગેરે ના બાંધકામ માટેનો ખર્ચ	0.00	0.00	0.00	0.00	7989.88	245.83	1000.00	1745.83	4000.00	4000.00	4000.00	4000.00	4000.00

ਸਰਕਾਰੀ ਸੇਵਾ ਵਿਭਾਗ
ਪੰਜਾਬ ਸਰਕਾਰ

ਕੋਡ	ਨਾਂ	ਕਿਸਮ	ਸੰਖਿਆ	ਮੁੱਲ	ਸੰਭਾਲ	ਮੁੱਲ	ਸੰਖਿਆ	ਮੁੱਲ	ਸੰਭਾਲ	ਮੁੱਲ	ਸੰਖਿਆ	ਮੁੱਲ	ਸੰਭਾਲ
40172	ਪੈਨਸ਼ਨ	ਪੈਨਸ਼ਨ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
40173	ਫਿਰਕਾਬੰਦੀ	ਫਿਰਕਾਬੰਦੀ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
40174	ਪੈਨਸ਼ਨ	ਪੈਨਸ਼ਨ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
40175	ਪੈਨਸ਼ਨ	ਪੈਨਸ਼ਨ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
40176	ਪੈਨਸ਼ਨ	ਪੈਨਸ਼ਨ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
40177	ਪੈਨਸ਼ਨ	ਪੈਨਸ਼ਨ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
40178	ਪੈਨਸ਼ਨ	ਪੈਨਸ਼ਨ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
40179	ਪੈਨਸ਼ਨ	ਪੈਨਸ਼ਨ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
40180	ਪੈਨਸ਼ਨ	ਪੈਨਸ਼ਨ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
40181	ਪੈਨਸ਼ਨ	ਪੈਨਸ਼ਨ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
40182	ਪੈਨਸ਼ਨ	ਪੈਨਸ਼ਨ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
40183	ਪੈਨਸ਼ਨ	ਪੈਨਸ਼ਨ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
40184	ਪੈਨਸ਼ਨ	ਪੈਨਸ਼ਨ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
40185	ਪੈਨਸ਼ਨ	ਪੈਨਸ਼ਨ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
40186	ਪੈਨਸ਼ਨ	ਪੈਨਸ਼ਨ	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00

गांधीनगर भडानगरपालिका

डेप्युटी टवल पर्य अंकित पत्र वर्ष २०२३-२०२४

बजेट शु.स	सह सं	आकृति शु.स	वर्ष २०२३-२०२४											
			०१/०४/२०२० शु.स नी भरिपर रकम	०१/०४/२०२१ शु.स नी भरिपर रकम	०१/०४/२०२२ शु.स नी भरिपर रकम	०१/०४/२०२३ शु.स नी भरिपर रकम	०१/०४/२०२४ शु.स नी भरिपर रकम	०१/०४/२०२२ शु.स नी भरिपर रकम	०१/०४/२०२३ शु.स नी भरिपर रकम	०१/०४/२०२४ शु.स नी भरिपर रकम	०१/०४/२०२२ शु.स नी भरिपर रकम	०१/०४/२०२३ शु.स नी भरिपर रकम	०१/०४/२०२४ शु.स नी भरिपर रकम	
१		३	५	६	७	८	९	१०	११	१२	१३	१४	१५	
११२		४०१८७	०.००	०.००	०.००	५०.००	०.००	०.००	०.००	१०.००	१०.००	१०.००	१०.००	
११२		४०१८८	०.००	०.००	०.००	५०.००	०.००	०.००	०.००	१०.००	१०.००	१०.००	१०.००	
११२		४०१९०	०.००	०.००	०.००	०.००	०.००	०.००	०.००	१०००.००	१०००.००	१०००.००	१०००.००	
११२		४०१९१	०.००	०.००	०.००	०.००	०.००	०.००	०.००	३५०.००	३५०.००	३५०.००	३५०.००	
११२		४०१९२	०.००	०.००	०.००	०.००	०.००	०.००	०.००	१२५.००	१२५.००	१२५.००	१२५.००	
११२		४०१९३	०.००	०.००	०.००	०.००	०.००	०.००	०.००	५०.००	५०.००	५०.००	५०.००	
११२		४०१९४	०.००	०.००	०.००	०.००	०.००	०.००	०.००	१५०.००	१५०.००	१५०.००	१५०.००	
११२		४०१९५	०.००	०.००	०.००	०.००	०.००	०.००	०.००	३५०.००	३५०.००	३५०.००	३५०.००	
११२		४०१९६	०.००	०.००	०.००	०.००	०.००	०.००	०.००	२००.००	२००.००	२००.००	२००.००	
११२		४०१९७	०.००	०.००	०.००	०.००	०.००	०.००	०.००	२००.००	२००.००	२००.००	२००.००	
११२		४०१९८	०.००	०.००	०.००	०.००	०.००	०.००	०.००	३००.००	३००.००	३००.००	३००.००	
			५९४.१८	१०६८.५४	२८०७.३०	३०३४०.३८	३४६९.५५	७९५४.६६	११४२४.२१	२८४७९.६७	२८४७९.६७	२८४७९.६७	२८४७९.६७	

ଅନୁବନ୍ଧ ୩୯ - ପ୍ରଶାସନିକ ଉପାଦାନ

କ୍ର. ସଂଖ୍ୟା	ବିବରଣୀ	୩୧	୩୨	୩୩	୩୪	୩୫	୩୬	୩୭	୩୮	୩୯	୪୦	
113	୩୯ ଶାସନିକ ଉପାଦାନ	0.00	110.57	597.34	200.00	4293.57	6301.61	3648.00	7187.00	7187.00	2187.00	7187.00
	୩୯୦୧-୧	0.00	0.00	0.00	0.00	0.00	0.00	136.00	135.77	135.77	135.77	135.77
	୩୯୦୧-୨	0.00	0.00	0.00	0.00	0.00	0.00	3385.00	2748.00	2748.00	2748.00	2748.00
	୩୯୦୧-୩	0.00	0.00	0.00	0.00	0.00	0.00	200.00	200.00	200.00	200.00	200.00
	୩୯୦୧-୪	0.00	110.57	597.34	200.00	4293.57	6301.61	10595.00	24443.28	24443.28	24443.28	24443.28
	୩୯୦୧-୫	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
113	୩୯ ଶାସନିକ ଉପାଦାନ	1539.81	3657.17	1858.18	2795.00	2776.00	2816.56	0.00	0.00	0.00	0.00	0.00
	୩୯୦୧-୧	0.00	0.00	0.00	0.00	0.00	0.00	127.70	350.00	350.00	350.00	350.00
	୩୯୦୧-୨	0.00	0.00	0.00	0.00	0.00	0.00	163.23	980.00	980.00	980.00	980.00
	୩୯୦୧-୩	0.00	0.00	0.00	0.00	0.00	0.00	220.00	1629.64	1629.64	1629.64	1629.64
	୩୯୦୧-୪	0.00	0.00	0.00	0.00	0.00	0.00	2806.60	579.00	579.00	579.00	579.00
	୩୯୦୧-୫	0.00	0.00	0.00	0.00	0.00	0.00	825.33	4142.77	4142.77	4142.77	4142.77
	୩୯୦୧-୬	0.00	0.00	0.00	0.00	0.00	0.00	180.00	220.00	220.00	220.00	220.00
	୩୯୦୧-୭	0.00	0.00	0.00	0.00	0.00	0.00	74.88	0.00	0.00	0.00	0.00
	୩୯୦୧-୮	0.00	0.00	0.00	0.00	0.00	0.00	74.99	152.00	152.00	152.00	152.00
	୩୯୦୧-୯	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	500.00	500.00	500.00	500.00
	୩୯୦୧-୧୦	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	300.00	300.00	300.00	300.00
	୩୯୦୧-୧୧	0.00	0.00	0.00	0.00	0.00	0.00	337.67	1250.00	1250.00	1250.00	1250.00
	୩୯୦୧-୧୨	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	300.00	300.00	300.00	300.00
	୩୯୦୧-୧୩	0.00	0.00	0.00	0.00	0.00	0.00	120.00	1405.64	1405.64	1405.64	1405.64
	୩୯୦୧-୧୪	0.00	0.00	0.00	0.00	0.00	0.00	160.00	240.00	240.00	240.00	240.00
	୩୯୦୧-୧୫	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	500.00	500.00	500.00	500.00
	୩୯୦୧-୧୬	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	25.58	25.58	25.58	25.58
	୩୯୦୧-୧୭	0.00	0.00	0.00	0.00	0.00	0.00	99.59	100.00	100.00	100.00	100.00
	୩୯୦୧-୧୮	0.00	0.00	0.00	0.00	0.00	0.00	403.97	173.00	173.00	173.00	173.00
	୩୯୦୧-୧୯	1858.18	3657.17	1858.18	2795.00	2776.00	2816.56	3592.56	12847.29	12847.29	12847.29	12847.29
	୩୯୦୧-୨୦	1539.81	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00